



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૫/૦૪/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૧૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૩ કેસ કરી, ૧૨ વ્યક્તિઓને ઝડપી, ૧૮ લીટર દેશી દારૂ, ૧૦ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૪ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૧ વ્યક્તિની અટક કરી જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૧૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૭૧૯/૧૯

પાલડી: સમકિત પ્રફુલચંદ્ર શાહ (ઉ.વ.૩૦) (રહે. શાંતિવન એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો જૈન ઉપાશ્રય પાસે પાલડી) તા.૨૪/૪/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે પાલડી રાજનગર શંકરાશ્રમના દરવાજા સામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ સમકિત શાહના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સમકિત શાહે પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એમ.એમ.સિંધી ચલાવે છે.

ચોથા માળેથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૭૨૦/૧૯

ચાંદખેડા: ચાંદખેડા સરલ અલ્ટેઝાની સાઈટ ખાતે રહેતા અને ત્યા જ સાઈટ ઉપર કામ કરતા રામકેશ રમેશપાલ (ઉ.વ.૧૯) તા.૨૩/૦૪/૧૯ સાજના ૫/૦૦ વાગ્યાના સુમારે સરલ અલ્ટેઝા સાઈટના ચોથા માળે બહારના ભાગે લોખંડ પાઇપ પકડી કલર કામ કરતા હતા ત્યારે પાઇપ તુટી જતા નીચે પડી જતા માંથામા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિષ્પજ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્ર ભગવાનરાવ ચલાવે છે.

ઇસનપુર: કસ્તુરભાઈ મુળજીભાઈ રાજપ્રિય (ઉ.વ.૬૫) (રહે. કાશી વિશ્વનાથ સોસાયટી વિભાગ-૨ ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૧૯/૦૪/૧૯ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૪/૪/૧૯ સાજના ૫/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વાય.જી.માથુક્રિયા ચલાવે છે.

કાગડાપીઠ: આકાશ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૧૬) (રહે.પઠાણની ચાલી ગીતામંદીર) એ અગમ્ય કારણસર તા.૨૪/૦૪/૧૯ બપોરના ૪/૧૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.વાઘેલા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.